

નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર

કામચલાઉ પસંદગી યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અંગે
અગત્યની જાહેરાત

નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા ગુ.રા.ના સંવર્ગ- ૩ની જાહેરાત ક્રમાંક 1/2016 થી 16/16 માટેની ભરતી બોર્ડ દ્વારા યોજાયેલ ભાગ-૧ની લેખિત પરીક્ષા માહે જુલાઈ-2017 અને ઓગષ્ટ-2017માં યોજાયેલ હતી તેના પરિણામના આધારે ભાગ-૨ની કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી મેરીટ આધારીત કામચલાઉ પસંદગી યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના બેઠક

નંબર <http://www.dfs.gujarat.gov.in> લીંક (LINK) ઉપર કલિક કરવાથી જોઈ શકાશે.

આથી આ કામચલાઉ પસંદગી યાદીમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને નીચે દર્શાવ્યા મુજબની તારીખ-સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્ર સહિત) ચકાસણી માટે નિયામકશ્રી, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, ગાંધીનગરની કચેરીએ અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખ-સમયે કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઈપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. વધુ માહિતી માટે વિભાગની વેબસાઈટ <http://www.dfs.gujarat.gov.in> જોવી.

જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	કામચલાઉ પસંદગી યાદી મુજબ ઉમેદવારોની સંખ્યા	પ્રમાણપત્ર ચકાસણીની તારીખ	સમય
01/2016-17	Scientific Assistant Class III Chemistry	23	26/03/2018	11:00 to 2:00
05/2016-17	Laboratory Technician Class III Chemistry Group	14		
09/2016-17	Laboratory Assistant Class III Chemistry Group	15	26/03/2018	3:00 to 6:00
02/2016-17	Scientific Assistant Class III Biology	21	27/03/2018	11:00 to 2:00
06/2016-17	Laboratory Technician Class III Biology Group	5	27/03/2018	3:00 to 6:00
10/2016-17	Laboratory Assistant Class III Biology	12		
14/2016-17	Store Keeper Class III	3		
16/2016-17	Assistant Examiner of Question Document Class III	2		
04/2016-17	Scientific Assistant Class III PSYCHOLOGY	2		
08/2016-17	Laboratory Technician Class III PSYCHOLOGY	1		
12/2016-17	Laboratory Assistant Class III PSYCHOLOGY	2		
03/2016-17	Scientific Assistant Class III Physics	24	28/03/2018	11:00 to 2:00
07/2016-17	Laboratory Technician Class III Physics Group	3		
11/2016-17	Laboratory Assistant Class III Physics Group	7		
13/2016-17	Searcher Class III (Finger Print Bureau)	11	28/03/2018	3:00 to 6:00
15/2016-17	Junior Expert, Class III, Finger Print Bureau	20		

ઉમેદવારે રજૂ કરવાના પ્રમાણપત્ર (અસલ + ૨(બે) પ્રમાણિત નકલો)

1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
2. જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય લાયકાત/અનુભવ અંગેના પ્રમાણપત્રો
3. જાતિ અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરેલ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
4. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નોન-કિમીલેયર પ્રમાણપત્ર
5. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં સિવિલ સર્જનનું નિયત પ્રમાણપત્ર
6. માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના આધાર પુરાવા તથા પ્રમાણપત્ર
7. વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો તથા પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર
8. કોમ્પ્યુટર અંગેના બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેના પ્રમાણપત્રો
9. તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા
10. રમતગમતના ઉમેદવારોના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબના નિયત નમુનામાં જરૂરી પ્રમાણપત્ર

11. ઉમેદવારે પોતાનું કોઇપણ એક આઇડેન્ટીટી પુફ જવું કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ લાવવાનું રહેશે તેમજ ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે.
12. જે ઉમેદવારો સરકારી સેવામાં ફરજો બજાવતા હોય તેવા ઉમેદવારોએ તેઓની કચેરી/ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/ સમયગાળાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
13. જાહેરાતક્રમાંક : ૧૩/૨૦૧૬ સર્ચર, વર્ગ-૩ (ફિંગરપ્રિન્ટ બ્યુરો) તથા જાહેરાત ક્રમાંક: ૧૫/૨૦૧૬ (ફિંગરપ્રિન્ટ બ્યુરો)માં પસંદગી પામેલ ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું તબીબી પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.

પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર રહેવાનું સ્થળ

નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગુજરાત રાજ્ય,
સેક્ટર-૧૮/એ, પોલીસ ભવન પાસે, ગાંધીનગર.

હેલ્પલાઇન નંબર : 079-23256390 (કામકાજના દિવસો અને કચેરી સમય
દરમિયાન)

સ્થળ : અમદાવાદ

નિયામક

તારીખ : 20-03-2018

ન્યાય સહાયક

વિજ્ઞાનની કચેરી,

ગુજરાત રાજ્ય